

અંગ્રેજી વ્યાકરણ [ભાગ 22] ગુજરાતીમાં

CHANGE THE VOICE

(1) Active voice અને

(2) passive voice. જેને ગુજરાતીમાં આપણે અનુક્રમે આપણે કર્તરી પ્રયોગ અનેકર્મની પ્રયોગ તરીકે ઓળખીએ છીએ.

(1)Active voice (કર્તરી પ્રયોગ) :-

જેમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય હોય છે. અને કર્તા તથા કર્મ સ્વસ્થાને હોયતો તે વાક્યActive Voice મા છે તેમ કહી શકાય.

e.g Mohan plays Cricket.

(2) Passive Voice (કર્મની પ્રયોગ) :-

જેમાં કર્તા કરતા તેના કર્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે.તેથી મૂળ કર્તાને કર્મને સ્થાને મુકવામાં આવેછે.આમ,કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે. તેને Passive Voice મા વાક્ય છે તેમ કહી શકાય.

e.g. -> Cricket is Played by Mohan.

• Active Voice નું passive Voice મા રૂપાંતર :-

Active Voice ની વાક્ય રચનાને Passive Voice માં રૂપાંતર કરતી વખતે કેટલાક ફેરફાર થાય છે.જેને આપણે ઉદાહરણ સાથે સમજીએ.

Rohan Watches movie (ActiveVoice)

કર્તા ક્રિયાપદ કર્મ

Movie watched Rohan (Passive Voice)

કર્તા IS ભૂ તક્રુદંત કર્મ

(‘કોણ’ પૂછવાથી જવાબ મળે તે કર્તા અને‘શું’ તથા ‘કોને’ પૂછવાથી જવાબ મળે તે કર્મ

આમ, વાક્યનું Active Voice માંથી Passive Voice મા રૂપાંતરકરતી વખતે નીચે પ્રમાણે ફેરફાર થાય છે. –

- (1) વાક્યમાં કર્તાનું સ્થાન કર્મ લે છે.
- (2) વાક્યમાં કર્મનું સ્થાન કર્તા લે છે.
- (3) કાળપ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે.
- (4) ક્રિયાપદનું ભૂ તકૃદંત મુકાય છે
- (5) વાક્યના અંતે By દ્વારા કર્તા, કર્મનું સ્થાન લે છે.

જ્યારે કર્તા કર્મ બને અને કર્મ કર્તા બને છે ત્યારે એકવચન કે બહુવચનના નામ મુજબ સહાયકારક ક્રિયાપદ મુકાય છે. સાથે સાથે સર્વનામમાં પણ ફેરફાર થાય છે. આપેલ કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય છે. અને કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય છે. પરંતુ જાતિવાચક નામ આપેલ હોય તો તેમાં ફેરફાર થતો નથી.

કર્તા વિભક્તિ

કર્મ વિભક્તિ

I	->	Me
We	->	Us
You	->	You
He	->	Him
She	->	Her
It	->	It
They	->	Them

Note :-

- Ø Voice બદલતી વખતે વાક્યનો કાળ બદલાતો નથી.
- Ø Passive Voice મા વાક્યમાં ક્રિયાપદનું ભૂ તકૃદંત રૂપ જ વપરાય છે
- Ø ચાલુ ભવિષ્યકાળ (Future Continuous Tense) તથા તમામ ચાલુ પૂર્ણ કાળ (Perfect Continuous Tense) ના વાક્યોનું Passive voice થઈ શકે નહિ.
- Ø ચાલું કાલ (Continuous Tense) ના Passive Voice મા ક્રિયાપદના ભૂ તકૃદંતના રૂપની સાથે being વપરાય છે.
- Ø Passive voice મા મોટા ભાગે 'by' વપરાય છે, અને ક્યારેક 'in' પણ વપરાય છે.

(1) સદોવર્તમાન કાળ (Simple Present Tense):-

Active voice:- ક્રિયાપદનું મૂળરૂપ (ક્યારેક – S-કે –es પ્રત્યાય સાથે)

Passive voice:- is / am/ are/ + ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ

e.g.-> He draws a picture.(Active)

A picture is drawn by him. (Passive)

->We hold these meetings in the office. (Active)

These meetings are held in the office.(Passive)

->He drinks water. (Active)

Water is drunk by him.

->વાક્યમાં જ્યારે કર્તા અથવા કર્મના સ્થાને શબ્દના બદલે phrase હોય ત્યારે તે phrase નું સ્થાન પણ બદલાય છે.

e.g.-> Mr.sharma manages a big industrial empire. (Active)

A big industrial empire is managed by Mr.Mehta. (Passive)

->The entire staff of our office respects Mr.Sinha. (Active)

Mr.Sinha is respected by the entire staff of our office. (Passive)

->જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદ સાથે નામયોગી અવયવ (preposition) જોડાયેલ હોય તો તે વાક્ય નું Passive માં રૂપાંતર કરતી વખતે preposition માં કોઈ ફેરફાર થતો નથી.

e.g. -> We object to this proposal. (Active)

This proposal is objected to by us. (Passive)

->A nurse looks after this little girl. (Passive)

This little girl is looked after by a nurse. (Passive)